



GUJARAT TECHNOLOGICAL UNIVERSITY

(Established Under Gujarat Act No.: 20 of 2007)

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી

(ગુજરાત અધિનિયમ ક્રમાંક : ૨૦/૨૦૦૭ દ્વારા સ્થાપિત)

Ref: જીટીયુ/કોરોના વોરિઅર્સ સ્પર્ધા/વિશેષ

Date: 03/05/2020

પ્રતિ,

આચાર્યશ્રી

સર્વે સંલગ્ન સંસ્થાઓ

વિષય: ગુજરાત રાજ્યનાં સ્થાપના દિન નિમિત્તે ગુજરાતનાં ગૌરવ અને અસ્મિતા સ્વરૂપ કોરોના વોરિઅર્સની ભૂમિકા વિષય પર ઇ-ફોર્મમાં ચિત્ર/નિબંધ/કાવ્યલેખન સ્પર્ધામાં વિદ્યાર્થીઓને ભાગ લેવા બાબતે...

મા. મહોદયશ્રી,

નમસ્કાર.

ઉપરોક્ત વિષય પરત્વે આદેશાનુસાર જણાવવાનું કે વૈશ્વિક કોરોના મહામારીએ સમગ્ર માનવજાતને ધરબંધીની ફરજ પાડી છે. એવામાં આ મહામારી સામે દિવસ-રાત પોતાના જીવના જોખમે કોરોના વોરિઅર્સ ફરજ નિભાવે છે. આવા કોરોના વોરિઅર્સને શત્ શત્ વંદન કરવા એ પ્રત્યેક ગુજરાતીની ફરજ છે. ડોક્ટર, નર્સ, પોલિસ, સમાજસેવકો, સફાઈકર્મીઓ એવાં અનેક સ્વરૂપે આપણી સુરક્ષા માટે સ્વયંનું બલિદાન આપવા માટે તત્પર આવા વોરિઅર્સને રાજ્ય પણ કઈ રીતે ભૂલે? ગુજરાત રાજ્યનાં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત ગૌરવ દિન તેમજ એની અસ્મિતાના મહિમાગાન સ્વરૂપે કોરોના વોરિઅર્સની ભૂમિકા વિષયક ચિત્ર, નિબંધ અને કાવ્યલેખનની ઇ-સ્પર્ધાનું આયોજન રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન દરેક સંસ્થાના વિદ્યાર્થીને આ ઇ-સ્પર્ધામાં ભાગ લેવા અને કોરોના વોરિઅર્સની ઉત્સાહવર્ધક આ ઝુંબેશમાં સહભાગી થવા વિશેષ અનુરોધ છે. ચિત્ર માટે A-3 પેપર અને કોઈ પણ પ્રકારના રંગોનો ઉપયોગ કરી શકાય છે. જ્યારે નિબંધ અને કાવ્ય સ્પર્ધાની કૃતિ ગુજરાતી કે અંગ્રેજી બન્નેમાંથી કોઈ એક ભાષામાં અપેક્ષિત છે. ચિત્ર, નિબંધ, કવિતા ઇ-ફોર્મમાં તા.10 મે, 2020 સુધી gtuevents@gtu.edu.in પર મોકલી આપવાની રહેશે. આ ઉપરાંત પ્રતિભાગીએ નામ, કોલેજનું નામ, સંપર્કનંબર ઇત્યાદિ વિગતો અચૂક મોકલવાની રહેશે.

રાજ્ય સ્તરની આ કોરોના વોરિઅર્સની સ્પર્ધામાં જીટીયુના વિદ્યાર્થી તરીકે જે કોઈ સહભાગી થશે અને વિજેતા બનશે તેને રાજ્ય સરકાર તરફથી તો પુરસ્કૃત કરવામાં આવશે જ, સાથે સાથે જીટીયુ પણ યુનિવર્સિટી સ્તરે સન્માનિત કરશે એની નોંધ લઈ આપની સંસ્થામાંથી મહત્તમ વિદ્યાર્થીઓ આમાં પ્રતિભાગી બને તે માટે યોગ્ય કરવા અનુરોધ છે.

આભારસહ.

સહી/-

(ડૉ. કે. એન. ખેર)

કુલસચિવ

Winners of : ICT Enabled University Award E-India - 2009 ❖ Manthan Award - 2009 ❖ GESIA Award - 2011
❖ Digital Learning WES - 2011 Award ❖ AIMS International Innovative University Award - 2013

Chandkheda : Nr. Campus of Vishwakarma Government Engineering College, Sabarmati - Koba Highway, Nr. Visat Three Roads, Chandkheda, Ahmedabad - 382 424. Gujarat, India Ph. : 079 - 232 67 500
Ahmedabad : 2nd Floor, ACPC Building, L. D. College of Engineering Campus, Navrangpura, Ahmedabad, (Gujarat) India - 380 015
Phone : + 91 - 79 - 26 300 499 / 599 Fax : + 91 - 79 - 26 30 1500
Gandhinagar : K-6 Circle, E-4 Electronic Estate G.I.D.C., Nr. Government Polytechnic, Sector-26, Gandhinagar - 382 028 Gujarat.
e-mail : info@gtu.ac.in URL : www.gtu.ac.in